

B.A. Semester - 6 (CBCS) Examination
March/April-2023 (NEW COURSE)
PHI P22 YogaDarshan (Core -22 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	ચિત્તભૂમી એટલે શું? તેના પ્રકારો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	ચિત્તવૃત્તિના અવરોધો વર્ણવો .	
પ્રશ્ન.૨	યોગદર્શન અને સાંખ્ય વચ્ચેનો સંબંધ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	ચિત્તનું સ્વરૂપ સમજાવી તેના પ્રકારો સમજાવો.	
પ્રશ્ન.૩	સમાધિ અને તેના પ્રકારો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	યોગમાં ઈશ્વરનું સ્થાન સમજાવો.	
પ્રશ્ન.૪	ચિત્તવૃત્તિના નિરોધના ઉપાય તરીકે અભ્યાસ અને વૈરાગ્ય સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	યોગના બહિરંગો સમજાવો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો (કોઈ પણ બે)	(૧૪)
	1) યોગની વર્તમાનમાં પ્રાસંગિકતા.	
	2) ક્રિયાયોગ સમજાવો.	
	3) કૈવાલ્યનું સ્વરૂપ સમજાવો.	
	4) પંચ કલેશ સમજાવો.	

ENGLISH VERSION

Que.1	What is Chittabhumi? Explain its types.	(14)
	OR	
Que.1	Describe the obstacles chittavrutti.	
Que.2	Explain relation between yoga and sankhya.	(14)
	OR	
Que.2	Explain of nature of Chitta and its types.	
Que.3	Explain the Samadhi and its types.	(14)
	OR	
Que.3	Explain the place of God in Yoga.	
Que.4	Explain the Abhyas and Vairagya as the remedy of Chittavrutti.	(14)
	OR	
Que.4	Explain the external organs of Yoga.	
Que.5	Write short answers: (any two)	(14)
	1. Importance of yoga in present era.	
	2. Explain the kriyayoga.	
	3. Explain the nature of Kaivalya.	
	4. Explain the five affliction.	
